



Market News

બજાર આજે મજબૂત તેજ સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. સેન્સેક્સ આજે 1047 અંક વધીને 57864 પર બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 312 અંક વધીને 17287 પર બંધ થયો છે. નિફ્ટી બેન્ક 680 અંક વધીને 36429 પર બંધ થયો છે. મિડકેપ 393 અંક વધીને 28,978 પર બંધ રહ્યો છે. સેન્સેક્સના 30 માંથી 28 શેરોમાં તેજ રહી છે. જ્યારે, નિફ્ટીના 50 માંથી 45 શેરોમાં તેજ જોવા મળી છે. જ્યારે નિફ્ટી બેન્કના 12 માંથી 10 શેરોમાં તેજ રહી. ડોલર સામે રૂપિયામાં પણ આજે મજબૂતી જોવા મળી છે. ડોલરની સામે આજે 47 પૈસા મજબૂત થઈને 75.80 ના સ્તર પર બંધ થયો છે.

કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો મજબૂતી સાથે બંધ થયો છે. 1 ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 47 પૈસા વધીને 75.79 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 76.26 ના સ્તર પર બંધ થયો હતો. પબ્લિક સેક્ટરની ઈન્ડિયન ઓઈલ, BPCL, HPCL અને MRPL ભારી માત્રામાં રશિયન ફૂડ ખરીદવાની તૈયારી કરી રહી છે. Economic Timesએ આ કેસથી સંબંધિત લોકોના બવાલાથી કહ્યું કે, આ માર્જિન દબાણને ઓછું કરવામાં મદદ કરવા માટે એક ભારી છૂટ પર જઈ રહી છે, ઘરેલૂ બજારમાં ઇંધણના ખર્ચમાં વધારાનો

પસાર કરવામાં અસમાર્થતા ને કારણે તેલ રિક્ષાઈનરનો સામનો કરવો પડી રહ્યો છે.

આ લોકોએ પહેલા કહ્યું હતું કે, યુકેન પરના આક્રમણ માટે રશિયા પર પશ્ચિમી પ્રતિબંધોને પગલે રશિયન તેલ માટે વીમા, માલ ઢુલાઈ અને પેમેન્ટ પર સ્પષ્ટતા મળ્યા બાદ કંપનીઓ એક કે બે દિવસમાં આ પગલું લેશે.

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ (credit rating agency Moody)એ આજે 2022 માટે ભારત માટે તેના પહેલા ગ્રોથ અનુમાનને 9.5 ટકા ઘટાડીને 9.1 ટકા કર્યો છે. Moodyના રિપોર્ટમાં કહ્યું છે કે ઈંધણ અને ફર્ટિલાઇઝર્સના વધતા ખર્ચને કારણે સરકારી નાણા પર ભાર પડી રહ્યો છે અને તેના તેની નિયોજિત કેપિટલ એક્સપેન્ડિચરમાં અવરોધ ઊભી થઈ રહી છે. જેના કારણે તેઓએ ભારતના ગ્રોથ અનુમાનને પહેલા આપેલા અનુમાનથી ઓછી છે. મૂડીઝે કહ્યું કે તેમના સંશોધનમાં અંતર્નિહિત મોમેન્ટમનો પણ સામેલ છે જેના વિષે પહેલા કોઈ હિસાબ નથી.

ગયા મહિને 2022-23 માટે જાહેર તેના વૈશ્વિક મેક્રો-ઇકોનોમિક આઉટલૂક (global macro-economic outlook)ના રૂપમાં ગયા અપડેટમાં એજન્સીએ ભારત માટે તેના 2022 કેલેન્ડર વર્ષની ગ્રોથ પૂર્વાનુમાન (growth forecast)એ 7 ટકાથી વધારીને 9.5 ટકા કર્યું હતું.

Results & Corporate Action



Corporate Action	Company Name	Type & Percentage	Record Date	Ex-Date
BONUS	Virinchi	Bonus Ratio 1:1	22-03-2022	21-03-2022
BONUS	BSE Limited	Bonus Ratio 1:1	22-03-2022	21-03-2022
BONUS	Nandan Denim	Bonus Ratio 1:1	25-03-2022	24-03-2022
BONUS	DJ Mediaprint	Bonus Ratio 1:1	25-03-2022	24-03-2022
SPLITS	Godha Cabcon	OLD FV 10 NEW FV1	~	24-03-2022
SPLITS	Vardhman Text	OLD FV 10 NEW FV2	~	24-03-2022
Rights	ASM Tech	Rights Ratio 1:10	21-03-2022	17-03-2022
Rights	SPV Global	Rights Ratio 1:10	22-03-2022	21-03-2022
DIVIDEND	Sun TV Network	Interim 100	21-03-2022	17-03-2022
DIVIDEND	GAIL	Final 50	22-03-2022	21-03-2022
DIVIDEND	Allcargo	Interim 150	25-03-2022	24-03-2022
DIVIDEND	RITES	Interim 100	25-03-2022	24-03-2022
DIVIDEND	Bharat Elec	Interim 600	26-03-2022	24-03-2022
DIVIDEND	TVS Motor	Interim 375	28-03-2022	25-03-2022

Nifty Spot in Last Week:-

ઉપરમાં ૧૭૩૪૪.૬૦ અને નીચામાં ૧૬૫૫૫.૦૦ નો ભાવ જોવા મળ્યો હતો.



NIFTY WEEKLY CHART



BANKNIFTY WEEKLY CHART

Nifty Spot in Upcoming Week:-

ઉપરમાં ૧૭૫૫૦ થી ૧૭૭૦૦ નો supply zone છે જો આ level પાસે થી reversal મળે તો નીચામાં ૧૭૨૦૦ થી ૧૬૮૦૦ સુધી નો ભાવ આવી શકે.

Bank Nifty in Upcoming week:-

ઉપરમાં ૩૭૪૦૦ થી ૩૭૮૦૦ નો supply zone છે જો આ level પાસે થી reversal મળે તો નીચામાં ૩૬૩૦૦ થી ૩૫૮૦૦ સુધી નો ભાવ આવી શકે.

Recommendation for next week

Serial No.	Stock Name Cash segment	Above / Below / Add HOLD	CMP as on 19.03.2022	Trail SL	Buy Stop loss	Sell Stop loss	Target
1	BIRLACABLE(BUY)	HOLD 136	156	140.50			195
2	GSFC(BUY)	CMP 146.80	146.80		138		176
3	SUMICHEM (BUY)	CMP 406.70	406.70		393		425-460

Commodity Market

COPPER:- ઉછાળે ૮૫૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૭૯૫ નો ભાવ આવી શકે.



CRUDEOIL:- ઉછાળે ૮૪૭૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૭૫૯૦ નો ભાવ આવી શકે.



SILVER: ઘટાડે ૬૪૮૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૬૨૪૦૦ નો s1 રાખવો ઉપરમાં ૬૯૦૦૦ સુધી નો ભાવ આવી શકે.



GOLD:- ઘટાડે ૫૦૬૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૪૯૭૦૦ નો s1 રાખવો ઉપરમાં ૫૨૦૦૦ સુધી નો ભાવ આવી શકે.



Currency Corner

Premium / Discount (USD/ INR) Based on Forward Rates	
Duration	Premium
One month Forward	0.32
Three month Forward	0.57
Six month	1.36
One year	3.05

RBI reference Rates	
Currency	Rates
USD	75.89
GBP	99.83
Euro	83.65
100 Yen	63.88

મોંઘા મૂલ્યોને કારણે રોકાણકારો શા માટે બાજુ પર બેઠા છે, હવે રોકાણ કરવું જોઈએ

રશિયા-યુક્રેન સંઘર્ષના કારણે છેલ્લા પાંચ મહિનામાં બજારમાં જોવા મળેલી અસ્થિરતા વધુ ખરાબ થઈ છે. રોકાણકારો, ખાસ કરીને નવા રોકાણકારો બજારની વિકસતી ગતિશીલતાથી અસ્વસ્થ થઈ શકે છે. અન્યત્ર, ઘણા નવા જમાનાના ફંડ હાઉસ ઓછા ખર્ચે નિષ્ક્રિય રીતે સંચાલિત યોજનાઓ સાથે આવ્યા છે, જેણે રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાક આંતરરાષ્ટ્રીય ભંડોળ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે.

તમે કેવી રીતે જુઓ છો કે રશિયા-યુક્રેન કટોકટી શેરબજારો પર અસર કરે છે?

વિશ્વભરની સેન્ટ્રલ બેંકો કોવિડ-19 રોગચાળાના પાછળના ભાગમાં વિસ્તરેલ નાણાકીય સમર્થન પાછું ખેંચી લેવાનું વિચારી રહી હતી. વધતી જતી કુગાવાની ચિંતા વધી રહી હતી અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પણ કુગાવાના વધારામાં ફાળો આપ્યો હતો. યુક્રેનનો મુદ્દો બીજી ગૂંચવણ ઉમેરે છે, કારણ કે તે સપ્લાય ચેઇનને અસર કરે છે. જ્યારે તેલ, ગેસ, કોલસાની વાત આવે છે, ત્યારે આ પટ્ટો નોંધપાત્ર સપ્લાયર છે. જ્યારે તમે રશિયા અને યુક્રેનને એકસાથે મૂકો છો ત્યારે તે એગ્રી-કોમોડિટી અને ધાતુઓનું નોંધપાત્ર સપ્લાયર છે. તેથી, આ વૈશ્વિક અર્થતંત્ર માટે અન્ય પુરવઠાના આંચકા સમાન છે.

જો પરિસ્થિતિ યથાવત્ રહેશે તો તે ભારતીય રિઝર્વ બેંક સહિતની મધ્યસ્થ બેંકો માટે નીતિને સામાન્ય બનાવવી (વ્યાજ દરોમાં વધારો) ખરેખર જટિલ બનાવશે કારણ કે ભાવમાં વધુ કોઈ વધારો કુગાવાને નકારાત્મક અસર કરે છે અને ગ્રાહક ખર્ચમાં ઘટાડો કરે છે. શ્રેષ્ઠ કેસ એ હશે કે યુક્રેનમાં માનવતાવાદી કટોકટી ફૂંકાય અને કેન્દ્રીય બેંકો તેઓ વધુ સારી રીતે સમજી શકે તેવા ચલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ હોય.

આ કરેક્શન દરમિયાન રોકાણકારોએ બજારોનો સંપર્ક કેવી રીતે કરવો જોઈએ?

રોકાણકારોએ તેમનું રોકાણ ચાલુ રાખવું જોઈએ. જો તેઓ મોંઘા વેલ્યુએશનને કારણે રોકડ રોકી રહ્યા હોય, તો તેનો ઉપયોગ કરવાની આ તેમની તક છે. લાર્જ-કેપ્સમાં, તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે મૂલ્યાંકન ઘટી ગયું છે. આ પહેલીવાર નથી જ્યારે આપણે વેલ્યુએશનને મોંઘા ઝીનમાં જતા જોયા હતા અને ભવિષ્યમાં આપણે ફરીથી વેલ્યુએશન સસ્તા ઝીનમાં જતા જોશું. મૂલ્યાંકનમાં વધઘટ થાય છે અને આના માટેના કારણો અને સમાચારો જુદા જુદા સમયે બહાર આવતા રહેશે. હકીકત એ છે કે વેલ્યુએશનનો અર્થ રિવર્ટ થાય છે. તેથી, જ્યારે મૂલ્યાંકન સમૃદ્ધ હોય ત્યારે રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ.

તમે કયા સેક્ટરમાં બુલિશ છો?

વેલ્યુએશન વાજબી લાગે છે અને કંપનીઓ ફાયનાન્સિયલ સ્પેસમાં ગ્રોથ અપસાઇડનો ફાયદો ઉઠાવવા માટે સારી જગ્યાએ લાગે છે. ઓટો સેક્ટરમાં, વોલ્યુમ તેમના ટોચના વોલ્યુમ કરતાં 20-30 ટકા નીચે ચાલી રહ્યું છે, જે નાણાકીય વર્ષ 2018-2019માં આવ્યું હતું. આ થોડું અસામાન્ય છે અને અમુક સમયે, માંગમાં વધારો થશે. તમે વધતી અર્થવ્યવસ્થામાં અપેક્ષા રાખતા નથી, ઓટો માંગ ત્રણ વર્ષની ટોચથી નીચે ચાલી રહી છે.

શા માટે UTI MF આટલા બધા નિષ્ક્રિય ફંડ્સ, ખાસ કરીને પરિભળ આધારિત ફંડ્સ લોન્ય કરી રહ્યું છે અને શા માટે હજુ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ફંડ નથી?

રોકાણકારો બંને વ્યૂહરચનાઓને બુદ્ધિપૂર્વક જોડી શકે છે. નિષ્ક્રિય બાજુએ, અમે પરિભળ-આધારિત રોકાણ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. પરિભળ-આધારિત વ્યૂહરચનાઓ દ્વારા, તમે સક્રિય વ્યૂહરચના લઈ શકો છો અને તેનો સાર કાઢીને તેને નિષ્ક્રિય વ્યૂહરચનામાં રૂપાંતરિત કરી શકો છો. શક્ય છે કે કોઈ ચોક્કસ રોકાણ વ્યૂહરચના કેટલાક પરિભળો દ્વારા સંચાલિત હોય, પરંતુ રોકાણ વ્યૂહરચના બનાવવાની એક સરળ રીત એ છે કે પ્રભાવશાળી પરિભળને ધ્યાનમાં લેવું અને તેની આસપાસ ઉત્પાદન બનાવવું. અમે હમણાં જ S&P BSE લો વોલેટિલિટી ઇન્ડેક્સ પર આધારિત લો વોલેટિલિટી ઇન્ડેક્સ ફંડ લોન્ય કર્યું છે અને નિફ્ટી મિડકેપ 150 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ માટે ફાઇલ કર્યું છે. એકવાર મ્યુચ્યુઅલ ફંડ્સ માટે વિદેશી રોકાણની મર્યાદામાં વધારો

થઈ જાય, અમે એક આંતરરાષ્ટ્રીય ફંડ ઓફ ફંડ લોન્ચ કરવાની પણ યોજના બનાવીએ છીએ.

નિષ્ક્રિય ભંડોળ તરફ આગામી દાયકા અથવા થોડા દાયકાઓમાં નવા પ્રવાહની શક્યતા છે. તે જ સમયે, આપણે બજારનું કદ વધારવાની વિશાળ તકને ભૂલવી જોઈએ નહીં. જ્યારે બચતના નાણાકીયકરણની વાત આવે છે, ત્યારે ભારતીય AMCસ માટે હજુ પણ મોટી તકો છે.

શું તમે સક્રિય ફંડ મેનેજરો માટે આઉટપરફોર્મન્સ જનરેટ કરવા માટે પડકારરૂપ બનવાની પણ અપેક્ષા રાખો છો?

બાકીના વિશ્વમાંથી આપણે જે શીખી શકીએ છીએ તે એ છે કે જેમ જેમ બજારો વધુ ને વધુ સંસ્થાગત બનતા જાય છે તેમ તેમ સંસ્થાકીય રોકાણકારોમાં આલ્ફા (આઉટપરફોર્મન્સ) જનરેટ કરવા માટે એકબીજા સાથે હરીફાઈ કરતા, સોફિસ્ટિકેશનની ડિગ્રી વધશે. તેથી, તે વધુને વધુ પડકારરૂપ બનશે. આલ્ફા અસ્તિત્વમાં હશે, પરંતુ તે સમજવું વધુ મુશ્કેલ બની શકે છે કે કઈ રોકાણ વ્યૂહરચના આલ્ફા બનાવશે. હમણાં માટે, બંને વ્યૂહરચનાઓ અસ્તિત્વમાં રહેવા માટે જગ્યા છે.

HEAD OFFICE

B/230-231, International Trade Center, Majura Gate, Ring Road, Surat-2.(Guj.) India Ph: 0261- 40 60 750, 246 27 90
Fax : 0261-246 27 91 www.markethubonline.com E-Mail : info@markethubonline.com

IA SEBI Registration no.:INA000005333

Disclaimer :

We do not represent that information provided by us is accurate or complete and it should not be relied upon as such. The advice provided here is just for knowledge purpose only. The user assumes the entire risk of any use made or not made of this information.

INVESTMENT IN EQUITY, MUTUAL FUND, EQUITY, CURRENCY & COMMODITY DERIVATIVES IS SUBJECT TO RISK. WE ARE DISTRIBUTOR OF MUTUAL FUND.

Client should read the Risk Disclosure Document (RDD) & Do's and Don'ts issued by SEBI & relevant exchanges before investing.